

ફેશ (નવા) વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

- સરકારી છાત્રાલયમાં પ્રથમ વખત પ્રવેશ મેળવવા અરજી કરતા વિદ્યાર્થી ફેશ વિદ્યાર્થી ગણાશે. ગત વર્ષમાં સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવીને રહેતા હોય પરંતુ, તેમનો અભ્યાસક્રમ બદલાયેલ હોય તેમજ કોઈ વર્ષની ગેપ પડેલ હોય તો તેવા વિદ્યાર્થીએ ફેશ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.
- સરકારી છાત્રાલયમાં ફેશ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના બરાબર વંચાય તેવા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.
- પ્રવેશ માટે અરજી કરનાર ફેશ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. કોલેજકક્ષામાં માર્કશીટમાં CGPA, CPA દર્શાવેલ હોય તો તેવા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ અરજી ફોર્મ ભરતી વખતે મેળવેલ ગુણની ટકાવારી દર્શાવવાની રહેશે.
- કુમાર તથા કન્યા છાત્રો માટે આવક મર્યાદા વાર્ષિક રૂ.૨,૫૦,૦૦૦/- રહેશે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને અગ્રતા આપવાની રહેશે. (સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.)
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, વિચરતી/વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓએ જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
- ધો.૧૧/૧૨માં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓએ ધો.૧૦ નું, ડીપ્લોમાં પાસ કરી ડીગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ ડીપ્લોમાંનું, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધો.૧૨ નું તેમજ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા સ્નાતક અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે.
- પ્રવેશ સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર મેરીટ મુજબ આપવામાં આવશે.
- પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઇટ જોવાની રહેશે. પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ છાત્રોને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E-mail મારફત જાણ કરવામાં આવશે.
- ઓનલાઇન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ છાત્રોએ સબંધિત સરકારી છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. જો કોઈ અરજદારની ઓનલાઇન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
- વેબ સાઇટ પર દર્શાવેલ વિગતો તેમજ વિદ્યાર્થી પાસે રહેલ ડોક્યુમેન્ટમાં દર્શાવેલ વિગતોનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ પ્રવેશ અરજી ફોર્મ ભરવાનું રહેશે. એક વાર અરજી સબમીટ કર્યા બાદ અરજીમાં કોઈ કોલમ કે વિગતોમાં સુધારો/વધારો કરી શકશે નહીં.
- વિદ્યાર્થીએ સરકારશ્રીના નિયમો/સૂચનાઓ તેમજ છાત્રાલયમાં પાળવાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- પ્રવેશની અરજી કરવાથી વિદ્યાર્થી છાત્રાલયમાં પ્રવેશ માટે હક્કદાવો કરી શકશે નહીં. સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ ધારા-ઘોરણો અને નિયમો મુજબ પાત્રતા ધરાવતા હશે તો જ તેને પ્રવેશ આપવામાં આવશે.

- આપની પ્રવેશની અરજી મંજૂર કર્યા બાદ સરકારશ્રીની સુચના મુજબ છાત્રાલય શરૂ કરવામાં આવશે ત્યાર બાદ જ વિદ્યાર્થીને છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે.
- છાત્રાલયમાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીના પ્રમાણપત્રોની ચકાસણી કરી પ્રવેશ આપવાની તથા છાત્રાલય ફેરફાર કરવાની તેમજ પ્રવેશ સંબંધિત તમામ સત્તાઓ જિલ્લા કક્ષાની છાત્રાલય પ્રવેશ સમિતિની રહેશે.
- પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
- છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
- છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે જ વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
- ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
- છાત્રોએ પ્રવેશ સંબંધિત સૂચનાઓ માટે સમયાંતરે ઉક્ત વેબસાઈટ જોવાની રહેશે. સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કર્યા બાદ છાત્રને તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E-mail મારફત જાણ કરવામાં આવશે.
- સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતીની જાણકારી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
- છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સરકારશ્રીએ નક્કી કરેલ વખતોવખતના નીતિ નિયમોનુ પુરેપુરી રીતે પાલન કરવાનું રહેશે.
- દરેક વિદ્યાર્થી અને વાલીએ પ્રવેશ મેળવતી વખતે નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે અને તેનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
- પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર તા.૧/૭/૨૦૨૧ ના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
- Covid-19 ની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે તે છાત્રાલયમાં રીન્યુઅલ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પ્રવેશની સંખ્યા, છાત્રાલયના મકાનની ક્ષમતા તેમજ માન્ય સંખ્યાને ધ્યાને રાખી ખાલી રહેતી જગ્યાઓ પર ફેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ અંગે વિદ્યાર્થી પ્રવેશ માટે કોઈ હક્ક દાવો કરી શકશે નહીં.
- સરકારશ્રીના ઠરાવમાં દર્શાવેલ જાતિ અને અભ્યાસક્રમની ટકાવારી મુજબ મેરીટના ધોરણે કેટેગરી પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.